



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૯/૦૨/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૧૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૮ કેસ કરી, ૫૬ વ્યક્તિઓને ઝડપી, ૧૬૦ લીટર દેશી દારૂ, ૬૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૩ સ્ફૂટર અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૨,૭૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૧૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૩૧૯/૧૯

ગુજરાત યુનિવર્સિટી: ભાવિકભાઈ રસીકભાઈ દરજી (રહે. પંચમ ફ્લેટ શિખર ફ્લેટ સામે લાડ સોસાયટી રોડ વસ્ત્રાપુર) એ તા.૧૮/૨/૧૯ નારોજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨/૧૨/૧૮ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે આરોપી ધીરજકુમાર ડાહ્યાભાઈ પ્રજાપતિ (રહે.પ્રજાપતિ વાસ વાસણા(રાસ) તા-બોરસદ જી-આણંદ હાલ રહે-સરસ્વતિ ટેનામેન્ટ ગંગાબા પાર્ક સોસાયટી પામોલ રોડ બોરસદ આણંદ) એ ભાવિકભાઈને ફોન કરી જણાવેલ તમે સિલાઈનુ કામ કરો છો જેથી તમારે આ શિલાઈ મશીનની જરૂર હોય તો ૫૫૦૦/- રૂપિયામા આપવામા આવશે. જેથી ભાવિકભાઈએ ૬ મશીન ખરીદવા જણાવતા ધીરજકુમારે તેના સુર્યોદય બેંકના ખાતામાં રૂપિયા ૩૩,૦૦૦/- જમા કરાવવા જણાવી જેમાંથી એક મશીન પેટે ૧૫૦૦/- રૂપિયા પરત આપવામા આવશે તેમ કહેતા ભાવિકભાઈએ થલતેજ ખાતેની ઇન્ડીયન ઓવરસીસ બેંકમાંથી એન.ઇ.એફ.ટી.દ્વારા રૂપિયા ૩૩,૦૦૦/- મોકલી આપેલ ત્યારબાદ ધીરજકુમારે જણાવેલ કે હુ ૧૫-૨૦ મિનીટમા મશીન લઈ નિકળુ છુ એમ જણાવી ફોન બંધ કરી ભાવિકભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.સી.ધુમ્મડ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૩૨૦/૧૯

શહેરકોટડા: વિજયભાઈ શિવરામ મોહીતે (ઉ.વ.૪૩) (રહે. વિશ્વંબર એપાર્ટમેન્ટ અંબર સિનેમાની બાજુમા બાપુનગર) એ તા.૧૮/૨/૧૯ સાજના ૫/૧૫ વાગ્યાના સુમારે અમદુપુરા એન.કે એસ્ટેટના દરવાજા પાસે પાર્ક કરેલ પોતાના એક્ટીવાની ડેકીનુ લોક તોડી ડેકીમાંથી અજાણી વ્યક્તિ પર્સની ચોરી કરી લઈ ગઈ હતી. પર્સમાં રોકડ રૂપિયા ૩૫,૦૦૦/- અને જરૂરી કાગળો તેમજ દસ્તાવેજ હતા. આ અંગેની ફરીયાદ વિજયભાઈ મોહીતે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એસ.પરમાર ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૩૨૧/૧૯

નરોડા: કમલેશભાઈ બિપીનભાઈ રાઠોડ (રહે. મહાજનીયાવાસ એસ.ટી.વર્કશોપ સામે નરોડા પાટીયા નરોડા) એ તા.૧૪/૨/૧૯ રાતના ૮/૦૦ વાગે નરોડા ગંગોત્રી સોસાયટી એસ.ટી.વર્કશોપ પાછળ પોતાની ટાટા સુમો ગાડી નંબર જીજે ૦૯ બીએ ૪૪૫૬ કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૧૫/૦૨/૧૯ કલાક ૫/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ કમલેશભાઈ રાઠોડે તા.૧૮/૨/૧૯ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.મોરી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૩૨૨/૧૯

નરોડા: અનામિકાબહેન રાજીવકુમાર (ઉ.વ.૪૦) (રહે. દિવ્યજીવન સીટી શ્રીરામ કુટીર પાસે નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૮/૨/૧૯ કલાક ૯/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી મહેન્દ્રસિંહ માધુસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.